



એસેસમેન્ટ અને ટેક્ષ કલેક્શન ખાતુ

(પશ્ચિમ ઝોન)

કચેરીનું સરનામું

વિભાગીય ડે.મ્યુનિસિપલ કમિશનરીની કચેરી

ડૉ.રમણભાઈ પટેલ ભવન,

ઉસ્મનપુરા ચાર રસ્તા પાસે,

અમદાવાદ.

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫

અંતર્ગત કલમ-૪(૧) બી (૧) મુજબ

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર

અધ્યતન કર્યા તા. ૩૦-૦૬-૨૦૧૮

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો

વહીવટી માળખુ

ડ.મ્યુનિસિપલ કમિશનર પદ્ધિમ ઝોન



આસી.મ્યનિ.કમિશનર પદ્ધિમ ઝોન



ડ.એસેસર અને ટેક્ષ કલેક્ટર (પદ્ધિમ ઝોન)



આસી.મેનેજર



ડિવીઝનલ સુપ્રિ. (બીટ)



વોર્ડ ઈન્સપેક્ટર

વોર્ડ						
૫૦૧-૫૦૭	૫૦૮-૫૧૪	૫૧૫-૫૨૧	૫૨૨-૫૨૮	૫૨૯-૫૩૬	૫૪૧-૫૪૫	૦૫૬૫-૦૫૭૪

૫૬૧

૫૫૧-૫૫૨

## કાર્યો અને ફરજો :-

એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન ખાતા દ્વારા અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ તમામ મિલકતો ઉપર મિલકતવેરો ઉધરાવવાની કામગીરી કરવામાં આવે છે. મિલકતોમાં રહેઠાણ તથા બિનરહેઠાણ મિલકતોનો સમાવેશ થાય છે, જે સાથે જ ભાડુઆત તાબે કે માલિક તાબે મિલકતો વપરાશમાં હોય છે. આ ખાતા દ્વારા ટેક્સની વસુલાત માટે પ્રોપર્ટીનું એસેસમેન્ટ કરવામાં આવે છે.

કરદાતાઓ તરફથી આવતી નીચે મુજબની અરજીઓનો નિકાલ ટેક્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- મિલકતની માલિકીના નામ ટ્રાન્સફર અને મિલકતના કબજેદારના નામમાં ફેરફાર કરવા.
- બી.પી.એમ.સી.એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબ વપરાશના પ્રકારના ધોરણે મિલકતની આકારણી ઘટાડવા અંગે
- એકજ મિલકતના બે બીલ આવતા હોય તો વધારાના બીલ રદ કરવા અથવા સમગ્ર મિલકતનું એક બીલ આવતું હોય તો વપરાશના ધોરણે જુદા જુદા બીલ કરવા અંગે.
- મિલકત ખાલી/બીનવપરાશ અંગે નોંધ રાખી ખાલી મિલકતનો ટેક્સ રીફડ મેળવવા
- નવી મિલકતનું એસેસમેન્ટ કે જૂની મિલકતોનો વપરાશ બદલાયો હોય , ભાડાના દરમાં ફેરફાર થયો હોય તો આકારણી રીવાઈઝ કરવા અંગે.
- મુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ આપવો.
- ચર્ટર્ડ એક્ટની વર્ષે જાહેરનામાની મુદતમાં વાંધા અરજીઓ સ્વીકારી એપેલેટ ખાતા દ્વારા તેનો પુરાવાના આધારે, સ્થળ તપાસ કરી નિકાલ કરવામાં આવે છે.
- નવી મિલકતોની આકારણી અથવા રીવાઈઝ કરવા માટે

નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગાર ભાડુઆતના ધોરણે વપરાશ કરવામાં આવતો હોય તેમજ વપરાશમાં ફેરફાર થયેલ હોય તો આકારણી રીવાઈઝ કરાવવા માટે મુનિસિપલ કોર્પોરેશનને નક્કી કરેલ ફોર્મમાં અરજ સાથે

- (૧) રહેઠાણ માટે મિલકતના માલીકીના પુરાવાની પ્રમાણીત નકલ, જમીન માલીકીનો ૭/૧ રનો ઉતારો, ઓર્જનાઈઝર પાસેથી કબજે મેળવ્યો હોય તો તેની કબજા પહોંચની પ્રમાણીત નકલ, રેશનકર્ડ, ગેસ કનેક્શનના પુરાવા વગેરે.
- (૨) બીન રહેઠાણ માટે ગુમાસ્તાધારાનું લાઇસન્સ, સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશનની પ્રમાણીત નકલ, વીજળીનું બીલ, ટેલીફોનનું બીલ વગેરે.

**જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બીલો રદ કરવા માટે**

જૂની મિલકત જમીનદોસ્ત ક્યારે થઈ તેના પુરાવા, જૂની મિલકત તોડી પાડ્યા અંગેની અરજ આપેલ હોય તેની પહોંચની જેરોક્ષ, નવી મિલકત બાંધવા અંગે ખાનની વિગત, બી.યુ.પરમીશન ક્યારે આપવામાં આવી છે તેની વીગત, નવી મિલકતની આકારણી ટેક્સ ખાતા દ્વારા ક્યા વર્ષથી કરવામાં આવી છે તેની વિગત, રદ કરવાના બીલોની જેરોક્ષ નકલ સાથે નિયત ફોર્મમાં અરજ કરવાની હોય છે.

## સમગ્ર મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

સમગ્ર મિલકતનું એક બીલ આવતું હોય તેના બદલે જગાના વપરાશ મુજબ મિલકતના ભાગલા પાડીને તે મુજબ ટેક્ષના બીલ મેળવવા માટે, અરજી ફોર્મ સાથે બીલની પ્રમાણિત નકલ, ભાડુઆત તાબે મિલકતના ભાડાના પુરાવામાં ભાડા કરારની પ્રમાણિત નકલ વગેરે રજુ કરવી.

### ● મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

અરજી ફોર્મ સાથે જુના ભાડુઆત મિલકત ખાલી કરી ગયાનો પુરાવો / કબજો સૌંઘ્યાનો પત્ર / કબજા કરારની નકલ, નવા ભાડુઆતનો ભાડા કરાર, ભાડુઆત ખાલી કરી ગયા હોય તો તે અંગે અ.મ્યુ.કોર્પો.ને જાણ કર્યા અંગે અગાઉ અરજી કરેલ હોય તો અરજી કાર્ડની નકલ, પ્રોપર્ટી ટેક્ષના છેલ્લા બીલની નકલ સામેલ રાખી નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

### - મિલકત ખાલી / બીનવપરાશ (નોન યુઝ) અંગેની નોંધ રાખવા માટે

જે તે નાણાંકીય વર્ષમાં અરજી સાથે પ્રોપર્ટી ટેક્ષના બીલની નકલ રજુ કરવાથી, જે તે નાણાંકીય વર્ષમાં મિલકત ૩૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી હશે તો મિલકતવેરાની રકમ મજરે મળી શકે નહિ. જે દિવસે અરજી આપવામાં આવી હશે તે તારીખથી ખાલીનો લાભ મળી શકશે. દરેક નાણાંકીય વર્ષમાં મિલકત ખાલી રહેવાની હોય તો અગાઉથી અરજી કરવાની છે. વર્ષના અંતે ખાલીનો લાભ આપવામાં આવે છે.

### - મ્યુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ કરવા માટે

મ્યુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાની પ્રમાણિત નકલ રજુ કરવી. છેલ્લા બીલની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

### - એકજ મિલકતના બે બીલ આવતાં હોય તો વધારાનું બીલ રદ કરવા બાબત.

અરજી સાથે ચાલુ બીલ તથા રદ કરવાના બીલની પ્રમાણિત નકલ કરી નિયત ફોર્મમાં અરજી કરવીન હોય છે.

### - બી.પી.અમ.સી.એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ-૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબની મિલકતની આકારણી ઘટાડવા માટે

નવી ફોર્મુલા અમલમાં આવ્યા બાદ નીચેના માંથી કોઈપણ ફેક્ટરમાં ફેરફાર થાય તો ૪૮૫/૧ મુજબ મ્યુ.કોર્પેરિશનને અરજી કરવાથી ટેક્ષમાં ફેરફાર કરી આપવામાં આવે છે.

**કારપેટ એરીયા :** કોઈપણ મિલકતમાં કારપેટ એરીયામાં ફેરફાર હોય તો તે અંગે નિયત ફોર્મમાં અરજી કરવાથી સ્થળ તપાસના આધારે ફેરફાર કરી આપવામાં આવશે.

**ફેક્ટર :** ૨ મિલકતના બાંધકામના વર્ષમાં ફેરફાર હોય તો ટેક્ષમાં ફેરફાર થાય. અરજદાર બાંધકામ વર્ષના પુરાવા સાથે અરજી આપે તો સ્થળ તપાસ કરી ટેક્ષ ઘટાડી આપવામાં આવશે.

**ફેક્ટર :** ૩ મિલકતના ઉપયોગ આધારિત ફેરફાર થાય તો જરૂરી પુરાવા રજુ કર્યેથી અરજી કરવાથી ટેક્ષ ઘટાડી આપવામાં આવે છે.

ફેક્ટર-૪ માલિકી સંબંધિત ફેક્ટરમાં એટલ કે ભાડવાતમાંથી માલિક થતા હોય પુરાવા સાથે અરજી કરવાથી તે મુજબ ફેક્ટરમાં ફરજાર કરી આપવામાં આવે છે.

#### - મિલકતના નામ ટ્રાન્સફર માટે

અરજી સાથે નામ ટ્રાન્સફર કરવા માટે સીટી સર્વેની પ્રમાણિત નકલ, જો મિલકત રજીસ્ટર્ડ કો. ઓ. હા. સોસાયટીમાં હોય તો પહેલાન લેટર અને શેર ટ્રાન્સફરના ઠરાવની ચેરમેન અથવા સેક્ટરની સહી

સિક્કાવાળી પ્રમાણિત નકલ, અથવા રજીસ્ટર્ડ દસ્તાવેજ અથવા ઈન્ડેક્ષની નકલ, અથવા કન્વેયન્સ ડિડની પ્રમાણિત નકલ જેના નામે મિલકત ટ્રાન્સફર કરવાની છે તેઓની અરજી ફોર્મમાં કોલમ નં. ૦૮ માં મિલકત ખરીદનાર બધાની સહી કરાવવી રજી કરવાથી કરી આપવામાં આવશે. આ મિલકતનો અરજી કર્યા તારીખ સુધીનો પુરેપુરો તમામ ટેક્ષ ભરી પહોંચની પ્રમાણિત નકલ નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

ક્રમાંક નં. ૨ થી ૧૦ ના દરેક ફોર્મની કિંમત રૂ. ૨/- રાખવામાં આવેલ છે.

#### જાહેરનામાના અનુસંધાનમાં ખુનિસિપલ મિલકતવેરાના આકારણી અંગે વાંધા અરજી કરવા માટે

દરવર્ષે ખુનિસિપલ કોર્પોરિશન દ્વારા ટેક્ષ બીલ ઈસ્યુ કરતા પહેલા જાહેરજનતા પોતાની મિલકતનો ટેક્ષ કેટલો છે તે જાણી શકે તે માટે ૧૫ દિવસ સુધી એસેસમેન્ટ રજીસ્ટરો જોવા જાહેરાત બે વર્તમાનપત્રો પ્રસિદ્ધ કરવામાં આવે છે. નાગરીકો વિનામૂલ્યે આવી નોંધ જોઈ શકે છે, તેનો ઉતારો કરી શકે છે અને નોંધ કે ટેક્ષ સામે કોઈ વાંધો હોય તો પુરાવા સાથે નિયત ફોર્મમાં નિયત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. વાંધા અરજીના નિકાલ માટે એપેલેટ ઓફિસર ઉપરોક્ત અરજીની સુનાવણી કરી નિકાલ કરશે. એપેલેટ ઓફિસરના હુકમથી અસંતોષ ન હોય તો આવો હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર સ્મોલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી શકાય છે. બીલ સામે ફરીયાદ કરી શકાતી નથી.

#### ખાસ નોટીસ સામેની વાંધા અરજી અંગે

હ્યાત મિલકતમાં કોઈ વધારાના બાંધકામ સમયે કે મિલકતોનો વપરાશ માલિક તાબેથી ભાડુઆત તાબે થાય કે રહેઠાણમાંથી બીનરહેઠાણમાં વપરાશ બીલવવાના લીધે ચાલતો ટેક્ષ વધારાના સમયે કારણોની વિગત સાથે મિલકત ધારકને ખાસ નોટીસ આપવામાં આવે છે. સદરહુ નોટીસ મળ્યાના ૧૫ દિવસમાં વાંધાના કારણો-પુરાવા સાથે વાંધા અરજી કરી શકાય અને આવી વાંધા અરજીનો નિકાલ જાહેરનામાના સંદર્ભમાં કરવામાં આવેલ વાંધા અરજીના નિકાલની તેમજ એપેલેટ આફિસર દ્વારા કરવામાં આવે છે.

#### મિલકત વપરાશ / પુનઃ વપરાશ સમયે કરવાની ફરજીયાત જાણા :

કોઈ પણ નવી મિલકત કે જુની બંધ મિલકતો પુનઃવપરાશ શરૂ કર્યાના ૧૫ દિવસમાં ખુનિસિપલ કોર્પોરિશનમાં બી.પી.એમ.સી.એક્ટના પરિશિષ્ટ એ ના પ્રકરણ-૮ ના રૂલ ૫ હેઠળ જાણ કરવી ફરજીયાત છે. નિયત કરવામાં આવેલ રીક્વીજીશન ફોર્મ ખુનિસિપલ કોર્પોરિશનની ઝોનલ કચેરીઓના ટેક્ષ વિભાગમાંથી વિના મુલ્યે મળી શકશે. સમયમર્યાદામાં મિલકતના વપરાશ કે મિલકતમાં થયેલ વધારાના બાંધકામ, બદલાયેલ ઉપયોગના પ્રકાર કે ભાડુઆત અંગે જાણ કરવામાં ન આવે તો આવી મિલકતોનો ટેક્ષ, ટેક્ષ ખાતા દ્વારા પુરાવાના અભાવે કરવામાં આવે છે અને બી.પી.એમ.સી.એક્ટ પરિશિષ્ટ-એ ના પ્રકરણ ૮ ના રૂલ ૮(૩) ની જોગવાઈ મુજબ આવા ટેક્ષ સામે વાંધો લેવાને મિલકતના માલિક અથવા ભોગવટો કરનારને પ્રતિબંધ નદરો.

## ● અરજી નિકાલની સમય મર્યાદા

તમામ પુરાવાઓ અરજી આપેલા હોય અને નવી ગણતરી મુજબ પૂરેપૂરો ટેક્ષ ભરપાઈ કરવામાં આવેલ હોય તો અરજીનો નીચે જણાવેલ સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે.

અનું નં.	અરજીનો પ્રકાર	અરજીના નિકાલની સમય મર્યાદા
૧	બી.પી.એમ.સી.એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકૃચુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ઘટાડાવા બાબત.	૧ માસ
૨	નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગરતો જૂની મિલકત ભાડુઆત પાસેથી કરવામાં આવેલ ભાડાના વધારાને લઈ તેમજ વપરાશ ફેરફાર થયેલ હોઈ આકારણી રીવાઈઝ કરવા.	૧ માસ
૩	મિલકતના કંજેદારમાં ફેરફાર કરવા બાબત.	૧૫ દિવસ
૪	મિલકતના ઉપયોગના પ્રકારમાં ફેરફાર	૧૫ દિવસ
૫	જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્ષના બીલો રદ કરવા	૧ માસ
૬	સમગ્ર મિલકતનું એક બીલ આવે છે તેના બદલે જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્ષ બીલ આપવા બાબત.	૧ માસ
૭	એકજ મિલકતના બે બીલ આવતા હોય તો વધારાનું બીલ રદ કરવા	૧ માસ
૮	મિલકતના નામ ટ્રાન્સફર માટે	૩૦ દિવસ
૯	અન્ય-સામાન્ય અરજીઓ	૧૫ દિવસ
૧૦	મિલકત ખાલી / નોન યુઝ અંગે	વર્ષ પુરુ થયા બાદ ૩૦ એપ્રીલ સુધી
૧૧	મ્યુ.વેલ્યુઅશેન અપીલના ચુકાદાનો અમલ લેવા અંગે	૧૫ દિવસ
૧૨	મિલકત વેરાની નવી આકારણી કરવા માટે	૦૮ દિવસ
૧૩	મિલકત વેરા રીફિડ માટે	૧૫ દિવસ

ઉપરોક્ત પ્રકારની અરજીઓના નિકાલ માટેની લધુતમ સમય મર્યાદા ખાતા દારા નિયત કરવામાં આવેલ છે. જો ઉપરોક્ત સમય મર્યાદામાં અરજીનો નિકાલ ન થાય તો સંબંધિત જોનનાં તેખ્યુટી એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરનો રૂબરૂ સંપર્ક કામકાજના દિવસોએ ત૩-૦૦ થી ૫-૦૦ માં કરવો.

બીલમાં નામ/સરનામાં (સ્પેલીંગ)અંગેની ભૂલ માટે પુરાવા સાથે સાદા કાગળ ઉપર અરજી કરવાથી તે અંગેનો નિકાલ કરવામાં આવશે.

આવી અરજીઓ કરવા જાહેર જનતાની અનુકૂળતા માટે ખૂબજ નજીવી ડિમતે છાપેલા ફોર્મ દ્વારા વિભાગ તથા દરેક જોન તથા દરેક સીવીક સેન્ટર ઉપરથી નાગરીકોને ઓફિસ સમયે વેચાણ આપવામાં આવે છે. તેમજ ભરેલ ફોર્મ કોઈપણ જોનની અરજી આપી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. નીચે મુજબના કેશ કલેક્શન કાઉન્ટરો રાખવામાં આવેલ છે.

બીલ મળ્યાના ૧૫ દિવસમાં જો બીલ ભરવામાં ન આવે તો ટેક્ષ બીલમાં જણાવેલ રકમ તેમજ પાછલા વર્ષની બાકી રકમ નિયમ મુજબ કાયદાકીય જરૂરી પગલાં લઈ દંડ સાથે વસૂલ કરવામાં આવે છે.

(૨) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો :-

ઓફિસ ઓર્ડર નં. ૨૦/૨૦૧૬-૧૭ તા. ૧૫-૧૦-૨૦૧૬

હવેથી ટેક્ષ ખાતામાં કોઈપણ મિલકતનો ટેક્ષ કમી કરવાનો થતો હોય (જુની તથા નવી ફોર્મ્યુલા)તો તે ફાઈલની મંજુરી અર્થે નીચે જગ્યાવ્યા મુજબના ફેરફાર અનુસાર જે તે અધિકારીશ્રીએ કાર્યવાહી કરવાની રહેશે.

- (૧) જો કોઈપણ મિલકત ટેક્ષ રૂ.૫૦,૦૦૦/- સુધી કમી થતો હશે તો જે તે ઝોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટરશ્રીએ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
- (૨) જો કોઈપણ મિલકતો ટેક્ષ રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/-સુધી કમી થતો હશે તો જે તે ઝોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટરશ્રીએ તેની મંજુરી અર્થે એસેસર અને ટેક્ષ ક્લેક્ટરશ્રીને મુકવાની રહેશે અને એસેસર અને ટેક્ષ ક્લેક્ટરશ્રીએ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
- (૩) જો કોઈપણ મિલકતનો પ્રોપર્ટી ટેક્ષ રૂ.૨,૦૦,૦૦૦/- (બે લાખ) સુધી કમી થતો હશે તો જે તે ઝોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટરશ્રીએ Dy.ATC ની કમીટી (ઓછામાં ઓછા ગ્રાન્ડ ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટર અને એસેસર ટેક્ષ ક્લેક્ટર)મારફત જે તે ઝોનના આસી.ભૂનિ.કમિશર થી સમક્ષ મંજુરી અર્થે મુકવાની રહેશે અને તે અંગેનો અંતિમ નિર્ણય તેમણે લેવાનો રહેશે.
- (૪) જો કોઈપણ મિલકતનો પ્રોપર્ટી ટેક્ષ રૂ.૭,૦૦,૦૦૦/- (સાત લાખ) સુધી કમી થતો હશે તો જે તે ઝોનના ડે.એસેસર અને ટેક્ષ ક્લેક્ટરશ્રી ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટર ની કમીટી સંબંધિત ઝોનના આસી.ભૂનિ.કમિશરશ્રીએ અરજની ચકાસણી કરી સંબંધિત ઝોનના ડે.ભૂનિસિપલ કમિશરશ્રી સમક્ષ ભલામણ સહ ફાઈલ રજુ કરવાની ઝોનલ ડેફ્યુટી ભૂનિસિપલ કમિશરશ્રીએ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
- (૫) જો કોઈપણ મિલકતનો પ્રોપર્ટી ટેક્ષ રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીશ લાખ) સુધી કમી થતો હશે તો જે તે ઝોનના ડેફ્યુટી એસેસર અને ટેક્ષ ક્લેક્ટરશ્રી+ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટરની કમીટી+સંબંધિત ઝોનના આસી.ભૂનિ.કમિશરશ્રીએ અરજની ચકાસણી કરી ડે.ભૂનિસિપલ કમિશરશ્રીઓની કમીટી સમક્ષ ભલામણ સહ ફાઈલ રજુ કરવાની રહેશે. સદરહુ કમીટીના પાંચ અધિકારીશ્રીઓ પૈકી ઓછામાં ઓછા ગ્રાન્ડ ડે.ભૂનિ.કમિશરશ્રીઓ + ડે.ભૂનિ.કમિશર(ટેક્ષ) મળી કુલ ચાર અધિકારીશ્રીઓએ તે અંગે અંતિમ નિર્ણય લેવાનો રહેશે.
- (૬) જો કોઈપણ મિલકતોનો પ્રોપર્ટી ટેક્ષ રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીશ લાખ) થી વધુ કમી થતો હશે તો સંબંધિત ઝોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટર+ ડે.એસેસર એન્ડ ટેક્ષ ક્લેક્ટરની કમીટી + સંબંધિત ઝોનના આસી.ભૂનિ.કમિશર+ડે.ભૂનિ.કમિશરશ્રીઓની કમીટીએ ભૂનિસિપલ કમિશરશ્રીને ભલામણ કરવાની રહેશે. જે અંગે ભૂનિ.કમિશરશ્રીનો અંતિમ નિર્ણય લેવાનો રહેશે.

સહી :

ડે.ભૂનિસિપલ કમિશર  
(વહીવટ)

### (૩) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી :-

ભૂનિ.ટેક્ષના નીતી-નિયમો જોગવાઈ તથા થયેલ પાવર્સ ડેલીગેશન મુજબ જે તે સત્તાધિકારે દ્વારા નિર્ણય લેવામાં આવે છે. જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે.

### (૪) કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો :-

કરદાતા દ્વારા ભૂનિ.ટેક્ષ લગત અરજાઓનો ટેક્ષના નીતી-નિયમો, ધારા-ધોરણો, પરિપત્ર વખતોવખત સમયમયાંદા માટે અમલી બનતી ઈન્સેન્ટીવ સ્કીમ મુજબ સમક્ષ સત્તાની મંજુરી મેળવી નિકાલ કરવામાં આવે છે. જે વેબ સાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે.

### (૫) કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિમયો વિ. :-

ટેક્ષ ખાતા દ્વારા થયેલ પરિપત્ર, નવી ફોર્મ્યુલા ટેક્ષ પણ્ઠતિના નિતિ-નિયમો, સુચનાત્મક આંદશો જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે. જે મુજબ કરદાતાઓની અરજીઓનો નિતિ-નિયમોનુસાર નિકાલ કરવામાં આવે છે.

### અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન

### એસેસમેન્ટ એન્ડ ટેક્ષ કલેક્ટર ડિપાર્ટમેન્ટ

#### સરક્યુલર નંબર.૦૧/૨૦૦૬-૨૦૦૭

આથી તમામ ઝોનના ડે.એસેસર અને ટેક્ષ કલેક્ટરશ્રીને જણાવવાનું કે સને ૨૦૦૫-૦૬ માં સરક્યુલર નં.૩ માં જણાવ્યા મુજબની સ્કીમનો અમલ તા.૩૧-૦૩-૨૦૦૬ સુધી કરવામાં આવેલ અને તે વનટાઈમ સેટલમેન્ટ તરીકે ગણાશે તે મુજબ તા.૩૧-૦૩-૨૦૦૬ પછી આ સ્કીમ અમલમાં રહેતી ન હોવાથી, હવે તા.૦૧-૦૪-૨૦૦૬ પછી જુના ઓફિસ ઓર્ડર નં. ૩૫૪૨ તા.૦૪-૦૬-૨૦૦૨ નો અમલ ચાલુ કરી ટેક્ષ કમીનો લાભ કરદાતાને આપવો. પરંતુ આ ઓફિસ ઓર્ડર મુજબ થતો પ્રોપર્ટી ટેક્ષ નવી ફોર્મ્યુલાના ટેક્ષ કરતાં ઓછો હોવો જોઈએ નહિ તથા જે તારીખે મંજુરી આપવામાં આવતી હોય તે તારીખના રોજ જેટલા વર્ષ-માસનો જુની ફોર્મ્યુલાનો ટેક્ષ ભિલકતવેરો બાકી હશે તેટલા વર્ષ-માસ માટે મળી શકશે. આનો લાભ બંધ મિલોને લાગુ પડશે નહિં.

સહી : યુ.સી.પડ્યા

તા.૧૩-૦૪-૨૦૦૬ ડે.ભૂનિ કમિશર (ટેક્ષ)

#### નકલ રવાના :

- (૧) તમામ ઝોનના ડે.એસેસર અને ટેક્ષ કલેક્ટરશ્રી
- (૨) તમામ ઝોનના આસી.મેનેજરશ્રી
- (૩) તમામ ઝોનના ડી.સુ.શ્રી
- (૪) સરક્યુલર ફાઈલે

## સીટી સીવીક સેન્ટરની યાદી

અ.નં.	ઝોન	સીટી સીવીક સેન્ટર	એડ્રેસ	ફોન નંબર
૧	પશ્ચિમ	લો ગાર્ડન	ગુજરાત લો સોસાયટીના મુખ્ય દરવાજા સામે, એલીસબ્રીજ અમ-૩૮૦૦૦૬	૨૬૫૬૦૭૨૭ ૨૬૪૦૫૮૦૫
૨	પશ્ચિમ	ઉસ્માનપુરા	ડો. રમણભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા ચાર રસ્તા આશ્રમરોડ અમદાવાદ-૩૮૦૦૧૩	૨૭૫૫૭૦૪૮ ૨૭૫૫૧૮૬૫
૩	પશ્ચિમ	વાસણા	વાસણા સીટી સીવીક સેન્ટર, સ્વીમિંગપુલ બિલ્ડિંગ, ગોદારી ફ્લેટની સામે, વાસણા	૩૦૮૧૦૨૪૧
૪	પશ્ચિમ	નવાવાડજ	નવાવાડજ મસ્ટરઆફિસ, નવાવાડજ સર્કલ, નવાવાડજ	૨૭૬૪૦૨૬૬
૫	પશ્ચિમ	ધરણીધર	કે.કે.શાસ્ત્રી વાંચનાલય, ધરણીધર દેરાસર સામે	૨૬૬૦૮૦૨૧
૬	પશ્ચિમ	ગાંધીગ્રામ	ગાંધીગ્રામ સબજોનલ ઓફિસ, હિમતલાલ પાર્ક સામે, આજાદ સોસાયટી	૨૬૭૬૦૨૪૩
૭	પશ્ચિમ	સરદાર પટેલ સ્ટેડિયમ	પંચશીલ સોસાયટી પાસે, નારણપુરા કોસીંગ, નારણપુરા	
૮	પશ્ચિમ	નારણપુરા	કામેશ્વર મહાદેવ પાસે, નારણપુરા	
૯	પશ્ચિમ	સાબરમતી	સાબરમતી સબજોનલ ઓફિસ, ટોરેન્ટ પાવર	૨૭૫૭૦૮૧૦
૧૦	પશ્ચિમ	ચાંદખેડા	જુની નગરપાલીકા ઓફિસ, ચાંદખેડા ગામ	૩૨૫૨૦૮૮૨ ૨૩૨૬૦૫૮
૧૧	ઉત્તર	નરોડા	રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ, મેઝ્કો ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૨૫	૨૨૮૪૪૬૪૨ ૨૨૮૦૩૩૮૮
૧૨	ઉત્તર	નરોડા-મુઠીયા	નરોડા મુઠીયા વોર્ડ ઓફિસ	૨૨૮૧૧૨૩૧
૧૩	ઉત્તર	સરદારનગર	સરદારનગર લાયબ્રેરી ભવન, સરદારનગર પોલીસ સ્ટેશન પાસે	૨૨૮૬૨૦૪૪
૧૪	ઉત્તર	સરસપુર	સરસપુર બાલભવન, કે.કે.આંખની હોસ્પિટલ પાસે, સરસપુર	૨૨૧૩૮૦૯૩
૧૫	ઉત્તર	કુબેરનગર	સી વોર્ડ, પાણીની ટાંકી પાસે, સરદારગ્રામ રેલ્વે સ્ટેશન સામે, કુબેરનગર	
૧૬	દક્ષિણ	રામબાગ	ભુ. બાલભવન, મણીનગર ફાયર સ્ટેશનની સામે, રામબાગ, મણીનગર, અમદાવાદ-૮	૨૫૪૬૬૩૨૯ ૨૫૪૫૩૮૦૬
૧૭	દક્ષિણ	ઈસનપુર	ઈસનપુર વોર્ડ ઓફિસ	૨૫૩૮૨૧૬૪
૧૮	દક્ષિણ	બાગેફિરદોશ	બાગેફિરદોશ વોર્ડ ઓફિસ	૨૫૮૫૪૦૯૬
૧૯	દક્ષિણ	કાંકરીયા	ભુનિ. સ્કુલ પાસે, પાસી અગીયારી પાસે, વેદ મંદિર રોડ, કાંકરીયા	
૨૦	દક્ષિણ	ઘોડાસર	નવા દાઝીલીમદા વોર્ડ આફિસ, ઘોડાસર	
૨૧	દક્ષિણ	વટવા	વટવા ગામ	
૨૨	પૂર્વ	રખિયાલ	વિમળભાઈ ભુ. લાયબ્રેરી ભવન, રખિયાલ ચાર રસ્તા અમદાવાદ-૩૮૦૦૨૧	૨૨૭૩૩૨૩૦ ૨૨૭૭૧૬૮૮
૨૩	પૂર્વ	ખોખરા	ખોખરા સર્કલ, રોકડીયા હનુમાનની બાજુમાં, ખોખરા	૨૨૭૪૮૦૮૧
૨૪	પૂર્વ	રાજપુર	રાજપુર સબજોનલ આફિસ, ચકુડીયા મહાદેવ પાસે, બળીયાકાકા રોડ	૨૨૭૪૦૨૦૫
૨૫	પૂર્વ	ભાઈપુરા	ભાઈપુરા વોર્ડ ઓફિસ, જુના એ. એમ. ટી. એસ. તેપોની	૨૫૮૫૨૫૪૪૪

			અંદર,હાટકેશ્વર સી.ટી.એમ.રોડ	
૨૬	પૂર્વ	ગોમતીપુર	ગોમતીપુર વોર્ડ ઓફિસ,ભુનિ.બાલભવન,ગોમતીપુર દરવાજા સામે,	૨૨૭૪૦૭૬૬
૨૭	પૂર્વ	નિકોલ	નવુ લાયબ્રેરી બીલ્ડિંગ,કિશા ટ્યુબવેલ સામે,નિકોલ	૨૨૭૦૦૧૬૦
૨૮	પૂર્વ	અમરાઈવાડી	અમરાઈવાડી સબઝોનલ ઓફિસ,માથુર માસ્તર ચાર રસ્તા પાસે,અમરાઈવાડી	૨૨૭૪૨૮૩૮
૨૯	પૂર્વ	બાપુનગર	ગાયત્રીમંદિર પાછળ,બાપુનગર	
૩૦	પૂર્વ	વસ્ત્રાલ	જુની નગરપાલીકા ઓફિસ,અજ્ય ટેનામેન્ટ વિભાગ-૫ ની બાજુમાં,વસ્ત્રાલ રોડ	
૩૧	મધ્ય	રીલીફ રોડ	રૂપમ સિનેમા સામે,રીલીફ રોડ,અમદાવાદ	૩૨૮૮૧૫૪૮ ૨૨૧૭૧૦૩૪
૩૨	મધ્ય	ગિરધરનગર	ગિરધરનગર વોર્ડ ઓફિસ,ગિરધરનગર	૩૨૮૮૧૨૪૧ ૨૫૬૨૬૪૫૪
૩૩	મધ્ય	હુંદેશ્વર	ભુ.બાલભવન,લાલાકાકા હોલ પાસે,હુંદેશ્વર	
૩૪	મધ્ય	જમાલપુર	જે.પી.સ્ટોર,એ.એમ.ટી.એસ.સ્ટાફ ક્વાર્ટ્સ સામે,જમાલપુર	
૩૫	મધ્ય	દરીયાપુર	કુટી માર્કિન પાસે,રૂપાપરી પોળ,દરીયાપુર દરવાજા,દરીયાપુર	
૩૬	મધ્ય	શાહપુર	શાહપુર વોર્ડ ઓફિસ,બાપુ સ્મૃતિકુંજ શાહપુર ચાર રસ્તા પાસે,	
૩૭	મધ્ય	ખાડીયા	જુના આંગારીયા નાકા,મહિપતરામ આશ્રમ પાસે,રાયપુર	
૩૮	નવા પ.જોન	બોડકદેવ	બોડકદેવ સીટી સીવીક સેન્ટર,અતિથી	૩૨૮૮૧૩૮૨
૩૯	નવા પ.જોન	વેજલપુર	વેજલપુર સીટી સીવીક સેન્ટર,જલતરંગ પોલીસ સ્ટેશન પાસે,જલતરંગ બસ સ્ટેન્ડ અમદાવાદ	૨૬૮૧૩૨૭૮ ૨૮૮૧૩૩૭૮ ૩૨૫૨૦૮૨૮
૪૦	નવા પ.જોન	રાણીપ	રાણીપ સીટી સીવીક સેન્ટર,જુના નગર પાલીકા બીલ્ડિંગ, મહેતા પાર્ટીલોટની સામે	૨૭૫૨૩૭૭૦
૪૧	નવા પ.જોન	ચાંદલોડીયા	ચાંદલોડીયા સીટી સીવીક સેન્ટર,ચાંદલોડીયા	૩૨૫૨૦૮૮૨
૪૨	નવા પ.જોન	વસ્ત્રાપુર	વસ્ત્રાપુર નગરપાલીકા ઓફિસ,વસ્ત્રાપુર ગામ	૩૨૫૦૬૦૦૨
૪૩	નવા પ.જોન	સરખેજ	સરખેજ વોર્ડ ઓફિસ,જુની નગરપાલીકા ઓફિસ,પાણીની ટાંકી પાસે	
૪૪	નવા પ.જોન	કાળી	કાળી વોર્ડ ઓફિસ,કાળી ગામ,દિગ્વીજ્ય પોસ્ટ ઓફિસ	૨૭૫૨૩૩૩૮
૪૫	નવા પ.જોન	ઘાટલોડીયા	ઘાટલોડીયા વોર્ડ ઓફિસ,ચાણક્યપુરી બ્રીજ નીચે,ઘાટલોડીયા	૩૨૫૨૦૮૮૦
૪૬	નવા પ.જોન	જોધપુર	જુની નગર પાલીકા ઓફિસ,રામજી મંદિર પાસે,જોધપુર ગામ,	૨૬૮૨૪૫૩૩

## ટેક્સ કલેક્શન સેન્ટર્સ

	મધ્ય	દાણાપીઠ	મુનિ.કોર્પો. કંમ્પાઉન્ડ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ	રૂ.૨૫૩૫૫૩૭૮
૨	નવા પ.જોન	મેમનગર	મેમનગર નગરપાલીકા ઓફિસ, માનવમંદિર પાસે	રૂ.૨૭૪૬૦૬૧૭
૩	પૂર્વ	વિરાટનગર	વિરાટનગર જોનલ ઓફિસ	રૂ.૩૮૮૧૨૪૩
૪	પાશ્વિમ	આર.ટી.ઓ.વ્હીકલ ટેક્સ કલેક્શન સેન્ટર	સુભાષભ્રાજ સર્કલ પાસે,	

મુનિસિપલ પ્રોપર્ટી ટેકના કર દરની નવી ફોર્મ્યુલા મુજબ માહિતી

(અમલ તા. ૦૧-૦૪-૨૦૦૧)

સામાન્યવેરાની ગણત્રીની ફોર્મ્યુલા

સામાન્યવેરો=વાર્ષિક×મિલકતનું ક્ષેત્રફળ×(ફેક્ટર:૧×ફેક્ટર:૨×ફેક્ટર:૩ ×ફેક્ટર:૪)

### વાર્ષિક દર :

ઉપરોક્ત ફોર્મ્યુલામાં મિલકતનો વાર્ષિકદર ચો.મીટર દીઠ મુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે બજેટ મંજુર કરતી વખતે જાહેર કરશે અને દર નક્કી કરતી વખતે કોર્પોરેશને આગામી વર્ષ દરમ્યાન કોર્પોરેશનની નાણાંકીય જરૂરીયાતો લક્ષમાં લેશે.

## મિલકતનું ક્ષેત્રફળ :

મિલકતનું ક્ષેત્રફળ આકારણી હેઠળની મિલકતના કારપેટ એરીયા ઉપરથી નક્કી કરવામાં આવશે. કારપેટ એરીયા ગણતી વખતે મિલકતની બાહ્ય અને આતરિક દિવાલો હેઠળના ક્ષેત્રફળ સિવાયનું મિલકતનું તમામ ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહેશે.

વર્ષ ૨૦૧૩-૨૦૧૪ થી રહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી.વાર્ષિક દર રૂ. ૧૬/- અને બીન રહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી.વાર્ષિક દર રૂ. ૨૮/- નક્કી કરવામાં આવેલ છે.

ફેક્ટરના પ્રકાર અને ફેક્ટર લાગુ પાડવાની પદ્ધતિ

### ફેક્ટર :- ૧ : સ્થળ પરિસ્થિતિ (Location) અંગેનો ફેક્ટર

અમદાવાદ શહેરનો કેટલોક વિસ્તાર સમૃદ્ધ છે, કેટલોક મધ્યમ કક્ષનો છે અને કેટલાક વિસ્તારમાં ગરીબ પ્રજા રહે છે તેથી અલગ અલગ વિસ્તારની સમૃદ્ધિ લક્ષમાં લઈને સ્થળ સ્થિતિ અંગે ફેક્ટર લાગુ પાડવાના રહે છે તેથી પ્રવર્તમાન જમીનની કિંમત પરથી (અ) સમૃદ્ધ વિસ્તાર (બ) સારો વિસ્તાર (ક) મધ્યમ વિસ્તાર (ડ) નબળો વિસ્તાર એમ ચાર વિભાગ પાડેલ છે.

રહેઠાણની મિલકતો માટે	અવયવ
સમૃદ્ધ વિસ્તાર	૧.૬૦
સારો વિસ્તાર	૧.૧૦
મધ્યમ વિસ્તાર	૦.૮૦
નબળો વિસ્તાર	૦.૬૦

બીન રહેઠાણની મિલકતો માટે વિસ્તારનું વિભાજન વધુ વાણિજ્ય શક્યતાઓ ધ્યાનમાં રાખીને કરેલ છે. સારી વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવ દર ઉંચો રાખવામાં આવેલ છે જ્યારે નબળા વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવ દર નીચો રાખવામાં આવેલ છે. આ અવયવોની કિંમત નીચે મુજબ રાખેલ છે.

બીન રહેઠાણની મિલકતો માટે	અવયવ
ખૂબજ સારી	૧.૬૦
સારી	૧.૧૦
મધ્યમ	૦.૮૦
નબળી	૦.૬૦

રાજ્ય સરકારના સ્ટેમ્પસ જ્યુટી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો માટે જમીનની કિંમતો નક્કી થાય છે તેનો આધાર લઈને શહેરના આ પ્રમાણે વિભાજન કરવામાં આવશે.

#### ફેક્ટર : ૨ મિલકતના બાંધકામના વર્ષ આધારીત ફેક્ટર

અ.નં.	મિલકતની ઉંમર	અવયવો
૧	દશ વર્ષ કે તેથી ઓછા સમયની	૧.૦૦
૨	દશ વર્ષથી વધુ પરંતુ વીશ વર્ષ સુધી	૦.૮૫
૩	વીશ વર્ષથી વધુ પરંતુ ગ્રીસ વર્ષ સુધી	૦.૭૦
૪	ગ્રીસ વર્ષથી વધુ પરંતુ ચાલી વર્ષ સુધી	૦.૬૦
૫	ચાલીસ વર્ષ કરતાં વધુ સમયની	૦.૫૦

#### ફેક્ટર : ૩

##### (અ) રહેઠાણવાળી મિલકતોનો પ્રકાર અંગેનો ફેક્ટર :

અમદાવાદ શહેરમાં રહેઠાણવાળી મિલકતોના જુદા જુદા પ્રકારો છે.

- (૧) ઝુંપડા (૨) ચાલી (૩) પોળ અને ગામતળના રહેઠાણવાળા મકાનો (૪) ફ્લેટ (૫) રોહાઉસ-ટેનામેન્ટ (૬) સ્વતંત્ર બંગલા

શહેરમાં આવેલ તમામ રહેણાંકની મિલકતોને ઉપરના પ્રકારો મુજબ વહેંચી તેના માટે નીચે મુજબના અવયવના દર રાખેલ છે.

અ.નં.	મિલકતોનો પ્રકાર	અવયવો
૧	ચાલી (૨૫ ચો.મી.કરતા વધુ)	૦.૫૦
૨	પોળ અને ગામતળ રહેઠાણવાળા મકાનો	૦.૭૦
૩	ફ્લેટ	૦.૭૦
૪	રોહાઉસ , ટેનામેન્ટ	૧.૦૦
૫	સ્વતંત્ર બંગલા	૧.૫૦

(બ) બીન રહેઠાણવાળી મિલકતોના પ્રકાર અંગેનો ફેક્ટર :

અમદાવાદ શહેરમાં વસવાટ સિવાયની મિલકતો જેનો જુદા જુદા પ્રકારે વપરાશ થાય છે. વપરાશને લક્ષમાં લઈ નીચે મુજબનું વિભાજન કરવામાં આવેલ છે અને તેના અવયવો નીચે મુજબ રાખવામાં આવેલ છે.

ક(૧) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધ ૭.૦

વાણિજ્યક હેતુઓ :

બેન્ક, દવાખાનું, હોસ્પિટલ, કલીનિક, પ્રસુતિગૃહ, લેબોરેટરી, કેન્દ્ર સરકારની કચેરી, રાજ્ય સરકારની કચેરી, સ્થાનિક મંડળોની કચેરી, પોસ્ટ ઓફિસ, વાણિજ્યક અને/અથવા ઔધોગિક એકમોની કચેરી, ઓઈલ કું.ની ઓફિસ, વિવધ કોપોરિશનની ઓફિસો, ટ્યુશન વર્ગો, ટાઇપીંગ સંસ્થા, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ અને આ ખંડના બીજા કોઈ પણ પેટા ખંડમાં આવતી ન હોય તે ઈમારતો

(૨) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૬.૦

દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો વગેરે :-

દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો, ઓપન એર થીયેટર, પેટ્રોલ પંપ, સર્વિસ સ્ટેશન, સીનેમા, કલબ હાઉસ, જીમખાના, કલબની મેસ, લોજંગ, લોજંગ એન્ડ બોર્ડિંગ, પાર્ટીપ્લોટ (કોમ્પ્યુનિટી હોલ સિવાય) ડિશ એન્ટેના, પેજર એન્ટેના ટાવર, સાઈન બોર્ડ, જાહેરખબરના પાટીયા, મોબાઈલ ફોન ટાવર, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ.

(૩) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધના ૨.૦

ઔધોગિક એકમો અને કારખાના (ફક્ત ઉત્પાદન તથા પ્રોસેસીંગ કરતી ઈમારતો માટે)

વીજણી કંપનીનું પાવર હાઉસ, વીજણી સબ-સ્ટેશન, એરેટેડ વોટર ફેક્ટરી, ભડા, બ્રાસ વર્ક્સ, બ્રીક અને સીરામીક વર્ક્સ, સીમેન્ટની વસ્તુઓ, કલે બનાવવાના એકમો, કેમીકલ ફેક્ટરી, કન્ફેક્શનરી, રેરી, ડિસ્ટીલીયર, ફાઉન્ડ્રી, ફ્લોર ફેક્ટરી, આર્યાન ફેક્ટરી, જીન્ક ફેક્ટરી, સીલ્વર ઓનમિન્ટ ફેક્ટરી, જગરી બનાવવાનું એકમ, લેધર મેન્યુફેક્ચરરીંગ યુનિટ, ચુના ચક્કી, ચુના ભડી, ઓઈલ એક્સટ્રેશન, પેપર મેન્યુ, પ્લાસ્ટિક ફેક્ટરી, પોટરી, સાગોળ મેન્યુ, સોપ મેન્યુ, સુગર મેન્યુ, ટીન ફેક્ટરી, તમાકુ ફેક્ટરી, વર્કશોપ, ફેક્ટરી સ્ટીમ જીલ, ઓટો ગેરેજ, ફેક્ટરી-એ, બી, સી, ડી, ઈ, એફ, મીલ, પાવરલુમ, હેન્ડલુમ, બોર્ન વોશીંગ, બ્લીચીંગ, કોટન સ્પીનીંગ અને ડાઇંગ બ્લીચીંગ ધાણીયાળ ફેક્ટરી, લેધર પ્રોસેસીંગ, સ્કીન ગ્રીન્ટીંગ, સલ્ફર પ્રોસેસીંગ, સ્ટાર્ચ પ્રોસેસીંગ, વરીયાળી પ્રોસેસીંગ, તુલ પ્રોસેસીંગ, કોલ્ડ સ્ટોરેજ, લાકડા પીઠા, ભડીયારખાના, રીપેરીંગ વર્ક્સ, નર્સરી (કુલ છોડ), અનીમલ માર્કેટ, દોરના તબેલા, પોલ્ટી ફોર્મ, દુધાળા ઢોરનો તબેલો, વે બ્રીજ, બાઈન્ડીંગ પ્રેસ, પ્રોસેસ સ્ટુડિયો, ફોટો સ્ટુડિયો, કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ

(૪) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સબંધમાં ૨.૦

શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ :-

ખાનગી નર્સરી (બાલમંદિર), ખાનગી અને સરકારી શાળાઓ, ખાનગી અને સરકારી કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, મ્યુઝીયમ, કોમ્પ્યુનિટી હોલ, પબ્લિક ચેરીટેબલટ્રસ્ટ દ્વારા સંચાલિત સામાજિક સંસ્થાઓ (નારી સરંકષણ તથા ઉત્થાન, ધરડાધર, બહેરામુંગા, અંધજન, મંદભુદ્ધી, શારીરીક ખોડખાંપણ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા નોન ગ્રાન્ટેબલ શાળાઓ).

(૫) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સબંધમાં, મુકરર કરેલ વધારી શકાશે નહિ અથવા ઘટાડી શકાશે નહિં.

પાણીની ટાંકી, વોટર પંપ રૂમ, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, ધોબીઘાટ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવતી ગ્રાન્ટેબલ શાળાઓ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવતી હોય તેવી બોર્ડિંગ-લોજંગ-હોસ્પિટ, ધર્મશાળા, આશ્રમ, ગ્રંથાલય

(૬) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સબંધમાં, મુકરર કરેલ, ૦.૦ વડે ગુણાંતા જે આવે તેટલો ઘટાડવો જોઈશે.

મંદિર, મસ્જિદ, દેરાસર (જૈન મંદિર), ચર્ચ, રોજા, કબર, ગુરુદ્વારા (શીખ મંદિર), અપાસરા, દરગાહ, અગિયારી, સમાધિ, ગ્રેબિયાર્ડ, કબ્રસ્તાન, સ્મશાનગૃહ, કુવો, હવાડો, હમામખાના (જાહેર બાથ), માટીના અખાડા, મદ્રેશા, પાઠશાળા, મફત પાણીની પરબ

**ફેક્ટર : ૪ મિલકતનો ઉપયોગ કોણા કરે છે તેને આધારિત ફેક્ટર :**

હાલમાં માલિક તાબે મિલકતોને ઘણો જ ઓછો ટેક્ષ ભરવો પડે છે જ્યારે ભાડુઆતને વધારે ટેક્ષ આવે છે. બંન્ને એકજ સરખી સવલતો ભોગવતો હોવા છતાં ટેક્ષમાં મોટો તફાવત રાખવો યોગ્ય જણાતો નથી. તેથી નવી ફોર્મ્યુલામાં મોટો તફાવત નહિં રાખવા ભાડુઆત તાબે મિલકતને થોડી રાહત આપવાનું યોગ્ય જણાયું છે.

અ.નં.	મિલકતનો ભોગવટો પરીબળ	અવયવ
૧	માલિકના ભોગવટાવાળી મિલકત	૧.૦૦
૨	ભાડવાતના ભોગવટાવાળી મિલકતો રહેઠાણ	૧.૦૦
૩	કોમર્શિયલ	૨.૦૦

કલમ ૧૪૧૬ (૧) તથા (૨) મુજબ શહેરની જે મિલકતો નોન-વોટર જોનમાં સમાવિષ્ટ થાય છે. તેના તેના સામાન્ય કરમાં ૧૫% રીબેટ આપવામાં આવશે તથા બીનરહેણાંકવાળી ગ્રાઉન્ડ ફ્લોર સિવાયની મિલકતોના સામાન્ય કરમાં ૨૦% રીબેટ આપવામાં આવશે.

આમ છતાં, ઓછામાં ઓછો સામાન્ય વેરો નીચે મુજબ છે.

(અ)

અ.નૂ.	મિલકતનું માપ	મિલકતનું માપ (ચો.મીટર)	લઘુતમ સામાન્યવેરો
૧	જુપડાં	--	૮૪.૦૦
૨	ચાલી	૨૫ ચો.મી.થી નાના	૨૬૪.૦૦
૩	અન્ય	૩૦ ચો.મી.થી નાના	૨૬૪.૦૦
૪	અન્ય	૩૦ ચો.મી.થી ૫૦ ચો.મી.સુધીના	૩૦૦.૦૦
૫	અન્ય	૫૦ ચો.મી.થી વધુ	૩૩૦.૦૦

રહેણાંકવાળી મિલકતો માટે

જુપડાં માટે મહતમ લઘુતમ સામાન્ય વેરો રૂ.૮૪/- તથા ૨૫ ચો.મી.થી નાના મકાનોવાળી ચાલીઓ માટે મહતમ લઘુતમ સામાન્ય વેરો રૂ.૨૬૪/- રહેશે.

(બ) બીનરહેણાંકવાળી મિલકતો માટે

અ.નૂ.	મિલકતનો પ્રકાર	મિલકતનું માપ (ચો.મીટર)	લઘુતમ સામાન્યવેરો
૧	બીનરહેણાંક	૧૫ ચો.મી.થી નાના	૫૪૦.૦૦
૨	બીનરહેણાંક	૧૫ ચો.મી.થી ૩૦ ચો.મી.સુધીના	૬૬૦.૦૦
૩	બીનરહેણાંક	૩૦ ચો.મી.થી વધુ	૭૮૦.૦૦
૪	પરિશિષ્ટ ૩ અને ૬ માં દશવિલ બીનરહેણાંક	---	૬૦૦.૦૦

વોટર ટેક્ષ : રેસી : સામાન્ય વેરાના ઉઠોં પ્રમાણે કોન્જરવન્સી ટેક્ષ : સામાન્યવેરાના ઉઠોં પ્રમાણએ

કોર્મશીયલ :

	પાણી	કોન્જરવન્સી
૬ ના ફેક્ટર-	૪૦%	૪૦%
૨ અને ૭ ના ફેક્ટર	૩૫%	૩૫%

પાણીના મીટર કનેક્શન માટે પ્રોરેટા ચાર્જ, પધતિ અનુસાર કનેક્શનની સાઈઝ પ્રમાણે વાર્ષિક પ્રોરેટા ચાર્જ મુજબ લેવાય છે.

માંગેલ કને.સાઈઝ	૧/૨ ઈંચ		
મેઠન લાઇનની સાઈઝ	ભરવાપાત્ર રકમ રૂપીયામાં		
	રહેઠાણ રૂ. ત/-	કોર્મશીયલ રૂ. ઈ/-	એરકન્ડીશન/ચણતર ફી રૂ. ૨૦/-
૩ ઈંચથી ૪ ઈંચ સુધી	૮૭૮/-	૨૩૪૪/-	૫૮૬૦/-
૪ ઈંચથી વધુ અને ૮ ઈંચ સુધી	૧૦૬૫/-	૨૮૪૦/-	૭૧૦૦/-
૮ ઈંચથી વધુ ૧૨ ઈંચ સુધી	૧૩૦૫/-	૩૪૮૦/-	૮૭૦૦/-

૩/૪ ઈંચ			૧ ઈંચ		
ભરવાપાત્ર રકમ (રૂપીયામાં)			ભરવાપાત્ર રકમ (રૂપીયામાં)		
રહેઠાણ રૂ. ત/-	કોર્મશીયલ રૂ. ઈ/-	એરકન્ડીશન/ચણતર ફી રૂ. ૨૦/-	રહેઠાણ રૂ. ત/-	કોર્મશીયલ રૂ. ઈ/-	એરકન્ડીશન/ચણતર ફી રૂ. ૨૦/-
૨૪૨૪/-	૬૪૬૪/-	૧૬૧૬૦/-	૪૮૮૬/-	૧૩૨૮૬/-	૩૩૨૪૦/-
૨૮૫૮/-	૭૮૮૮/-	૧૮૭૨૦/-	૬૧૦૫/-	૧૬૨૮૦/-	૪૦૭૦૦/-
૩૬૨૭/-	૮૬૮૨	૨૪૧૮૦/-	૭૪૬૭/-	૧૮૮૧૨/-	૪૮૭૮૦/-

અમદાવાદ મહાનગર પાલીકાની હૃદમાં ભેળવવામાં આવેલ નગરપાલીકા અને પંચાયતના વિસ્તારો માટે

બોઝે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૪૫૫ હેઠળ મળેલ સત્તાની રૂઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મિલકત વેરાની વસુલાત અંગે કારપેટ એરીયા બેઝ ફોર્મ્યુલા હેઠળ મિલકત વેરાની વસુલાત કરવા સબંધિત ૨૦૦૧-૨૦૦૨ થી અમલમાં મુકેલ બી.પી.એમ.સી.એક્ટની કલમ-૧૪૧ (બી) મુજબની પ્રોપર્ટી ટેક્ષની કારપેટ એરીયા બેઈઝ, નવી ફોર્મ્યુલાના શીડ્યુલ-૧૦, પ્રકરણ-૮ માં નિયમ-૮ (૪) નો ઉમેરો.

## વ्यवसायवेरा विभाग

રાજ્ય સરકારે તા.૦૧-૧૦-૨૦૦૬ થી વ્યવસાયવેરાની કામગીરી અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનને કલેકટોર એજન્ટ તરીકે સોપેલ.ત્યારબાદ તા.૦૧-૦૪-૨૦૦૮ થી અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનને રેજિસ્ટ્રેટ ઓથોરીટી તરીકે વેરો લાદવાની તથા વસુલ કરવાની તમામ કામગીરી સોપવામાં આવેલ છે. વ્યવસાયવેરાને પાત્ર નવા કરદાતાઓની નોંધણી, જુના કરદાતા અને નવા કરદાતાઓની બાકી વેરાની વસુલાતની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરાને લગતી તમામ કામગીરી નીચે જણાવેલ જોન પ્રમાણે કરવામાં આવે છે. તે માટે નીચે જણાવેલ અધિકારીનો સંપર્ક કરવો.

### વ્યવસાયવેરા ખાતાની કામગીરી :

વ્યવયાવેરા ખાતા દ્વારા વ્યવસાયવેરાને પાત્ર થતા હોય તેવા એનરોલમેન્ટ સર્ટિફિકેટ ફોલ્ડર (ઈ.શી.હોલ્ડર) અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોલ્ડર (આર.સી.) ની વેરો લાદવાની તથા વસુલ કરવાની કામગીરી જે તે જોન દ્વારા ઉપર જણાવેલ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરો ભરવા માટે વ્યક્તિએ નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય.

૧. એનરોલમેન્ટ સર્ટિફિકેટ : એનરોલમેન્ટ સર્ટિફિકેટ અ.મ્યુ.કોર્પોરેશનની હદમાં કરતાં ડેક્ટરો, વકીલો, એજન્ટો, કન્સલ્ટન્ટ, ટુર ટ્રાવેલ ઓપરેટરો, કમિશન એજન્ટો, એડવારાઇઝીંગ એજન્સી, શેર દલાલો, ભાગીદારી પેઢીઓ, ફેક્ટર્સ, ગુમાસ્તાધારા હેઠળ નોંધાયેલ તમામ પેઢીઓ, પલ્બિક અને પ્રાઈવેટ લીમીટેડ કંપનીઓ, નાણાં ધીરનારાઓ, સ્ટેમ્પ વેન્ડરો વગેરે (વિગતવાર લીસ્ટ શીડ્યુલ ૧ ની એન્ટ્રી નં. ૨ થી ૧૦ જોવુ) ને તા.૦૧-૦૪-૨૦૦૮ થી પોતે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશનની હદમાં દરેક બ્રાંન્ચ માટે નોંધણી કરાવી રૂ. ૨,૦૦૦/-વ્યવસાયવેરો અ.મ્યુ.કોર્પોરેશનના કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરવાને પાત્ર થાય છે. જે વ્યવસાયકારો વેટ હેઠળ ડિલર તરીકેની વાખ્યામાં સમાવેશ થતો હોય તેમણે તા.૦૧-૦૪-૨૦૦૮ થી નીચે મુજબ વાર્ષિક વ્યવસાયવેરો ભરવાનો થાય છે.

૧. રૂ. ૨,૫૦,૦૦૦/- સુધી ટર્ન ઓવર હોય તો સૂચ્ય
૨. રૂ. ૨,૫૦,૦૦૦/- થી રૂ. ૪,૮૮,૮૮૮/- રૂ. ૫,૦૦/-
૩. રૂ. ૫,૦૦,૦૦૦/-થી રૂ. ૮,૮૮,૮૮૮/- રૂ. ૧,૨૫૦/-
૪. રૂ. ૧૦,૦૦,૦૦૦/-થી વધુ રૂ. ૨,૪૦૦/-

એનરોલમેન્ટ સર્ટિફિકેટ મેળવવા માટે વ્યવસાયકારે ફોર્મ નં. ૩ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્શ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાર્ડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જેવા આનુષાંગિક પુરાવાઓ રજુ કરવા જોઈએ.

ફોર્મ નં. ૩ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા જોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્શ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.મ્યુ.કોર્પોરેશનની વેબ સાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર પ્રોફેશનલ ટેક્શમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક / ડિમાન્ડ ડ્રાઇટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો મુનિસિપલ કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકશે. ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામુ, ટેલીફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલાણની જરૂરીયાત નથી.

૧. રજીસ્ટ્રેશન સાર્વિક્સેટ : (આર.સી.) રજીસ્ટ્રેશન અ.મ્યુ.કોપોરિશનની હદમાં જે એમ્પલોયર એક અથવા તેથી વધુ કર્મચારીઓને નોકરીએ રાખતા હોય અને તેઓ પગાર અથવા વેતની ચુકવણી કરતાં હોય તેમણે રજીસ્ટ્રેશન સાર્વિક્સેટ મેળવવું ફરજીયાત છે.

રજીસ્ટ્રેશન સાર્વિક્સેટ માટે એમ્પલોયરે ફોર્મ નં. ૧ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્ષ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાર્ડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જોવા આનુષાંગિક પુરાવાઓ રજી કરવા જોઈએ.

ફોર્મ નં. ૧ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા ઝોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્ષ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.મ્યુ.કોપોરિશનની વેબસાઇટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર પ્રોફેશનલ ટેક્ષમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકાશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક/ડિમાન્ડ પ્રાફ્ટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકાશે. ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામું, ટેલીફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલાણની જરૂરીયાત નથી.

જે એમ્પલોયરે ૨૦ કે તેથી ઓછા કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલ દરો મુજબ વેરો કાપી દર ત્રણ માસ પુરા થયા બાદ દિન-૧૫ માં તેમજ જે એમ્પલોયરે ૨૦ થી વધુ કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલ દરો મુજબ વેરો કાપી દર માસે માસ પુરો થયાના દિન-૧૫ માં કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર વ્યવસાયવેરો ભરવાનો થાય.

## વેરાનો દર

ક્રમ	માસીક પગાર / વેતનની રકમ રૂ.	વ્યવસાયવેરાનો દર રૂ.
૧	રૂ.૬૦૦૦/- થી ઓછા	શુન્ય
૨	રૂ.૬૦૦૦/- અથવા તેથી વધુ પરંતુ રૂ.૮૦૦૦/- થી ઓછા	૮૦/-
૩	રૂ.૮૦૦૦/- અથવા તેથી વધુ પરંતુ રૂ.૧૨૦૦૦/- થી ઓછા	૧૫૦/-
૪	રૂ.૧૨૦૦૦/- અથવા તેથી વધુ	૨૦૦/-

ખાસ નોંધ :- રાજ્ય સરકારે તા.૦૧-૦૪-૨૦૦૮ થી અમલી બને તે રીતે શીડ્યુલ-૧ એન્ટ્રી નં. ૧ એ જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પંચાયત તેમજ પબ્લિક સેક્ટર અન્ડરટેક્સિંગ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ૧૦૦% ગ્રાન્ટ લેતી સંસ્થાઓ સિવાયના તમામ એમ્પલોયરને ફરજીયાતપણે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરિશનની હદમાં હોય તેમણે એમ્પલોયર તરીકેનો વ્યવસાયવેરો અમદાવાદ મ્યુનિસિપલ કોપોરિશનમાં સીટી સીવીક સેન્ટર ઉપર ભરવાનો થાય જેની જાહેર જનતાને જાણ કરતી જાહેરાત તમામ અગ્રગણ્ય અભિબારોના છેલ્લા પાના ઉપર તા. ૨૧-૦૪-૨૦૦૮ અને તા. ૦૮-૦૫-૨૦૦૮ ના રોજ આપવામાં આવેલ છે.

**અરજી / ફરીયાદ :** વ્યવસાયવેરાની લગતી કોઈપણ પ્રકારની અરજી કે ફરીયાદ અથવા રજુઆત જોનલ ઓફિસના પ્રોફેશન ટેક્ષ વિભાગમાં આપી શકાશે.

વ્યવસાયવેરાની માહિતી

વ્યવસાયવેરાના દર ફોર્મ નં.૧,ફોર્મ નં.૩,ફોર્મ નં.૫ વ્યવસાયવેરો કોને લાગુ પડે છે તેની વિગતો તેમજ વ્યવસાયવેરાને લગતા પ્રશ્નો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

#### (૬.) નિયંત્રણ હેઠળના દસ્તાવેજોના વર્ગોનું પત્રક :

મિલકતના ખુનિ.ટેક્ષના ડિમાન્ડ,માગણાની રકમ,ટેક્ષ ભયની તથા બાકી ટેક્ષની કોમ્પ્યુટરાઈઝ વિગતો તથા કરદાતાની અરજીઓ,નિકાલની કાર્યવાહીની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

#### (૭.) નિતિ અથવા તેના અમલીકરણના ઘડતર સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમયની

##### ગોઠવણીની વિગતો :

જે-તે વોર્ડના વોર્ડ ઈન્સપેક્ટર,જે-તે બીટના ડીવીઝનલ સુપ્રિન્ટેન્ન્ટ,વિભાગના આસી.મેનેજર,જોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી કક્ષાના અધિકારી/કર્મચારીનો જે-તે કરદાતા ખુનિ.ટેક્ષના પ્રશ્ન/મુશ્કેલી તથા અરજીના નિકાલ જેવી બાબતે ૩/૦૦ થી ૫/૩૦ દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકે છે.

#### (૮.) બોર્ડ વિ.બેઠકો લોકો માટે ખુલ્લી છે,બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ? :-

આ વિભાગને લાગુ પડતું નથી.

(લ) અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :-

ખાતાનું નામ : ટેક્ષ પણ્યિમ ઝોન

ખાતાનું સરનામું : ડૉ.રમણલાલ પટેલ ભવન ઉસ્માનપુરા, અમદાવાદ

ખાતાનો ટે.નં. ૨૭૫૫૨૦૪૭

અનું નં.	એમ્પલો.નં	કર્મચારીનું નામ	હોદ્ડો / ગ્રેડ	વોર્ડ	રીમાર્ક્સ
૧	૧૦૨૮	શ્રી દિપકભાઈ પટેલ	ડ.એસેસર એન્ડ.ટેક્ષ કલેક્ટર ૬૭૭૦૦ ૨૦૮૭૦૦	પણ્યિમ ટેક્ષ વિભાગ વડા અધિકારી	
૨	૧૦૧૫	શ્રી મનીષભાઈ શાહ	આસી.મેનેજર ૬૭૭૦૦ ૨૦૮૭૦૦	૫૦૧ થી ૫૦૭ ૫૧૫ થી ૫૨૧ ૫૨૮ થી ૫૩૬	૦૫૬૫ થી ૦૫૭૪
૩			આસી.મેનેજર ૫૩૧૦૦ ૧૬૭૮૦૦	વહીવટ	ઈન્ચાર્જશ્રી સોનીયાબેન ભાવસાર
૪	૧૦૧૫	શ્રી મનીષભાઈ શાહ	આસી.મેનેજર ૫૩૧૦૦ ૧૬૭૮૦૦	૫૦૮ થી ૫૧૪ ૫૨૨ થી ૫૨૮ ૫૬૧	
૫	૪૧૧૮૬	શ્રી સોનીયાબેન ભાવસાર	આસી.મેનેજર ૫૩૧૦૦ ૧૬૭૮૦૦	વ્ય.વેરો ૫૪૧ થી ૫૪૫ ૫૫૧ થી ૫૫૨	
૬	૪૧૨૮૧	શ્રી સુશાંત રાવલ	આસી.મેનેજર ૫૩૧૦૦ ૧૬૭૮૦૦		એસ.આર.એફ.ડી.સી. એલ.ફા.
૭	૭૨૩૬૩	શ્રી નરસિંહભાઈ એન.ગામેતી	ઓ.એસ. ૪૪૬૦૦ ૧૪૨૪૦૦	વહીવટી કામગીરી ડી.સુ. ૦૫૬૫ થી ૦૫૭૪	
૮	૮૫૭૮	શ્રી જગદિશભાઈ પટેલા	હેડ કલાર્ક ૩૪૪૦૦-૧૧૨૪૦૦	વ્ય.વેરો ૫૧૭ થી ૫૨૦ ૫૨૬ થી ૫૩૬ ૫૪૧ થી ૫૪૫ ૫૫૧, ૫૫૨	
૯	૭૩૦૧૦	શ્રીબાબીબેન રાજ્યુત	જુ.લીગલ આસી. ૪૪૬૦૦-૧૪૨૪૦૦	કોર્ટ મેટરની લગતી કામગીરી	
૧૦	૮૮૦૮	શ્રી કેલાશબેન ભગોરા	ડી.સુ. ૩૪૪૦૦-૧૧૨૪૦૦	૫૦૧-૫૦૭	
૧૧	૮૫૭૭	શ્રી રામજીભાઈ પરમાર	ડી.સુ. ૩૪૪૦૦-૧૧૨૪૦૦	૫૦૮-૫૧૪, ૫૬૧	

૧૨		જગ્યા ખાતી	ડી.સુ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૫-૫૨૧	ઈન્ચાર્જશ્રી રામજીભાઈ પરમાર
૧૩		જગ્યા ખાતી	ડી.સુ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૨૨-૫૨૮	ઈન્ચાર્જશ્રી રામજીભાઈ પરમાર
૧૪		જગ્યા ખાતી	ડી.સુ.	૫૨૯-૫૩૬	ઈન્ચાર્જશ્રી કેલાશબેન ભગોરા
૧૫		જગ્યા ખાતી	ડી.સુ. ૫૪૧-૫૪૫ ૫૫૧-૫૫૨	૫૪૧-૫૪૫ ૫૫૧-૫૫૨	ઈન્ચાર્જશ્રી રામજીભાઈ પરમાર
૧૬	૭૮૨૧	શ્રી અમૃતભાઈ ટી.સાગર	ડે.શિરસ્ટેદાર ૩૪૮૦૦-૧૧૨૪૦૦		ફાળવણી હાઉસીંગ સેલ
૧૭	૭૮૦૮	શ્રી કમલેશભાઈ કોણ્ઠી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૦૧	
૧૮	૮૦૬૨૦	શ્રી દિનેશભાઈ મકવાણા	વો.ઇ. ૧૯૬૦૦-૬૩૨૦૦	૫૦૨	
૧૯		જગ્યા ખાતી	વો.ઇ. ૧૯૬૦૦-૬૩૨૦૦	૫૦૩	ઈન્ચાર્જ શ્રી વો.ઇ. વીરલભાઈ કાપડીયા (જુ.કલાક)
૨૦	૮૧૨૩૮	શ્રી સુરેન્દ્રભાઈ પટેલ	વો.ઇ. ૨૫૫૦૦-૮૧૧૦૦	૫૦૪	
૨૧	૧૯૦૨	શ્રી આશિષ ત્રિપાઠી	વો.ઇ. ૧૯૬૦૦-૬૩૨૦૦ (૨૫૨૦૦)	૫૦૫	ઓ.એમ.ટી.એસ.થી પ.જોન ફાળવણી
૨૨	૭૮૦૮	શ્રી કમલેશભાઈ કોણ્ઠી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૦૬	ઈન્ચાર્જ શ્રી વો.ઇ.
૨૩			વો.ઇ.	૫૦૭	ઈન્ચાર્જ વો.ઇ. વીરલ કાપડીયા
૨૪			વો.ઇ.	૫૦૮	ઈન્ચાર્જશ્રી વો.ઇ. હસમુખભાઈ ચૌધરી
૨૫	૮૮૭૫	બીજીતાબેન શાહ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૦૯	
૨૬	૮૩૫૩	શ્રી હસમુખભાઈ ચૌધરી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૦	ફાળવણીથી ટેક્ષ પણ્ણીમ જોન
૨૭	૮૪૧૨	ઉષાબેન પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૧	
૨૮	૮૭૦૨	કોલીનભાઈ કંથારીયા	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૨	
૨૯	૮૪૮૮	શ્રી ધનંજ્યભાઈ પંડ્યા	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૩	
૩૦		જગ્યા ખાતી	વો.ઇ.	૫૧૪	ઈન્ચાર્જશ્રી વો.ઇ. કોલીનભાઈ કંથારીયા
૩૧	૮૮૬૩	પ્રકાશ ચૌહાણ	વો.ઇ.	૫૧૫	બીજા ખાતામાંથી

			૩૪૮૦૦-૧૧૨૪૦૦		ફાળવણી
૩૨	૮૪૨૬	શ્રી ધર્મન્દ્રભાઈ ભગત	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૬	ઈન્ચાર્જશ્રી વો.ઇ.
૩૩	૮૪૮૮	શ્રી ધનંજ્યભાઈ પંડ્યા	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૭	ઈન્ચાર્જશ્રી વો.ઇ.
૩૪	૮૬૨૮	શ્રી પીનાબેન પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૧૮	
૩૫	૮૪૨૬	શ્રી ધર્મન્દ્રભાઈ ભગત	વો.ઇ. ૨૫૫૦૦-૮૧૧૦૦	૫૧૯	
૩૬	૨૦૪૪	શ્રી પંડ્યા સંદિપકુમાર રમણલાલ	વો.ઇ. ૧૯૯૦૦-૬૩૨૦૦ (૨૨૪૦૦)	૫૨૦	એ.એમ.ટી.એસ.થી પ.ઝોન ફાળવણી
૩૭	૯-૧૧૧૧૭	શ્રી ઈન્દ્રજિત ચાવડા	વો.ઇ. ૨૫૦૦-૮૧૧૦૦ (૩૬૪૦૦)	૫૨૧	એ.એમ.ટી.એસ.થી પ.ઝોન ફાળવણી
૩૮	૮૫૪૧	શ્રી લક્ષ્મીબેન પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૨૨	
૩૯	૮૬૬૦	શ્રી મનીખાબેન શાહ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૨૩	
૪૦	૮૩૦૦	શ્રી ડોડીયા ચંદુભાઈ	વો.ઇ. ૨૫૫૦૦-૮૧૧૦૦	૫૨૪	
૪૧		શ્રી આનલબેન શાહ	વો.ઇ.	૫૨૫	ઈ-ગર્વનન્સ થી ફાળવણી પ.ઝોન
૪૨		જગ્યા ખાલી	વો.ઇ.	૫૨૬	ઈન્ચાર્જશ્રી વો.ઇ. ડોડીયા ચંદુભાઈ
૪૩	૧૮૧૭	શ્રી ભીખાભાઈ દેસાઈ	વો.ઇ. ૧૯૯૦૦-૬૩૨૦૦ (૨૫૨૦૦)	૫૨૭	એ.એમ.ટી.એસ.થી પ.ઝોન ફાળવણી
૪૪	૮૫૮૭	શ્રી કૌશીકભાઈ પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૨૮	
૪૫	૮૮૩૪	શ્રી ઉધાબેન મોદી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૨૯	
૪૬	૨૦૪૫	શ્રી ચાવડા રાભસિંહ મોતીસિંહ	વો.ઇ. ૧૯૯૦૦-૬૩૨૦૦ (૨૨૪૦૦)	૫૩૦	એ.એમ.ટી.એસ.થી પ.ઝોન ફાળવણી
૪૭	૮૨૭૦	શ્રી નરેશભાઈ પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૩૧	
૪૮	૧૯૧૪	શ્રી પટેલ મહેશભાઈ ચીમનલાલ	વો.ઇ. ૧૯૯૦૦-૬૩૨૦૦ (૨૨૫૦૦)	૫૩૨	એ.એમ.ટી.એસ.થી પ.ઝોન ફાળવણી
૪૯		જગ્યા ખાલી	વો.ઇ.	૫૩૩	ઈન્ચાર્જ વો.ઇ.

			૬૩૦૦-૩૪૮૦૦		નરેશભાઈ પટેલ
૫૦	૮૭૬૧	શ્રી સિમતાબેન બારોટ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૩૪	
૫૧	૮૮૧૧	શ્રી મસબિન કિસ્ટી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૩૫	
૫૨		શ્રી મુકેશભાઈ હરીભાઈ પટેલ	વો.ઇ.	૫૩૬	એ.એમ.ટી.એસ.થી પ.જોન ફાળવણી
૫૩	૮૬૨૫	શ્રી બાલુભાઈ તડવી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪૧	
૫૪		જગ્યા ખાલી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪૨	ઈન્દ્રજિતશ્રી રામજીભાઈ પટેલ
૫૫		જગ્યા ખાલી	વો.ઇ. ૧૬૬૦૦-૬૩૨૦૦	૫૪૩	ઈન્દ્રજિતશ્રી હસમુખભાઈ પટેલ
૫૬	૮૧૬૫૪	હસમુખભાઈ પટેલ	વો.ઇ. ૧૬૬૦૦-૬૩૨૦૦	૫૪૪	
૫૭		જગ્યા ખાલી	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪૫	ઈન્દ્રજિતશ્રી નરસિંહભાઈ ઓઝાત
૫૮	૮૬૦૭	નરસિંહભાઈ ઓઝાત	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪૬	
૫૯	૮૭૧૮	રામજીભાઈ પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪૭	
૬૦	૧૬૦૨	શ્રી આશિષ ત્રિપાઠી	વો.ઇ. ૧૬૬૦૦-૬૩૨૦૦ (૨૫૨૦૦)	૫૪૯	ઈન્દ્રજિતશ્રી એ.એમ.ટી.એસ.થી પ.જોન ફાળવણી
૬૧			વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૬૫	ઈન્દ્રજિતશ્રી પ્રકાશભાઈ ચૌહાણ
૬૨			વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૬૬	ઈન્દ્રજિતશ્રી હસમુખ ચૌધરી
૬૩			વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૬૭	ઈન્દ્રજિતશ્રી પંકજભાઈ પટેલ
૬૪	૮૬૮૮	શ્રી પંકજભાઈ પટેલ	વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૬૮	નવા પણ્યિમ થી પણ્યિમ ઝોન ફાળવણી
૬૫			વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૬૯	ઈન્દ્રજિતશ્રી બાલુભાઈ તડવી
૬૬			વો.ઇ. ૨૫૫૦૦-૮૧૧૦૦	૦૫૭૦	ઈન્દ્રજિતશ્રી ગૌરવભાઈ ભંગ
૬૭	૮૮૮૦	શ્રી ગૌરવભાઈ ભંગ	વો.ઇ. ૨૫૫૦૦-૮૧૧૦૦	૦૫૭૧	નવા પણ્યિમ થી પણ્યિમ ઝોન ફાળવણી
૬૮	૮૬૦૨		વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૭૨	ઈન્દ્રજિતશ્રી મોહનભાઈ તબીયાર
૬૯		શ્રી મોહનભાઈ તબીયાર	વો.ઇ.	૦૫૭૩	નવા પણ્યિમ થી પણ્યિમ

			૩૪૮૦૦-૧૧૨૪૦૦		ઝોન ફાળવણી
૭૦			વો.ઇ. ૩૪૮૦૦-૧૧૨૪૦૦	૦૫૭૪	ઈન્ચાર્જ શ્રી કૌશિક પટેલ
૭૧	૭૪૧૩	શ્રી પ્રેમજ્ઞભાઈ દાફડા	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦		સીટી સેન્સસ ખાતે ફાળવણી
૭૨	૮૬૫૧	શ્રી અલ્કાબેન પટેલ	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦	વ્ય.વેરો	
૭૩	૮૭૬૬	શ્રી ભાવનાબેન સોલંકી	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦	વ્ય.વેરો	
૭૪	૮૪૦૨	શ્રી રીમાબેન કે.શાહ	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી થયેલ કાઉ.ક્ષ
૭૫	૮૬૩૦	શ્રી અમરીખભાઈ ત્રિવેદી	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી જન્મ મરણ ખાતે
૭૬	૮૮૮૮	શ્રી જ્યેશભાઈ શાહ	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી વહીવટ પણ્યિમ ઝોન
૭૭	૮૮૨૮	શ્રી તેજસભાઈ પટેલ	જુની.કલાર્ક ૧૯૬૦૦-૬૩૨૦૦		ફાળવણી વેલ્યુઅશેન
૭૮	૮૪૫૩	શ્રી કવિતાબેન મહેતા	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણીથી આવેલ ટેક્ષ પ.ઝોન
૭૯	૭૨૧૮૫	શ્રી કિશોરભાઈ પરમાર	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી બીલ કલાર્ક
૮૦	૮૬૮૦	જગ્જાબેન જે.સોની	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી ટેક્ષ પણ્યિમ ઝોન
૮૧	૮૩૬૮	સરસ્વતીયંદ ઠક્કર	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી નવા પણ્યિમ ઝોન
૮૨	૭૨૮૨૧	ભાનુમતીબેન વણકર	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦	કન્ટી.કલાર્ક	
૮૩	૮૬૯૬	નિમીખાબેન શાહ	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦		ફાળવણી પણ્યિમ ઝોન વહીવટ
૮૪	૮૭૪૧	પટેલ શૈલેષભાઈ એલ.	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦		ફાળવણી પણ્યિમ ઝોન વહીવટ
૮૫	૮૭૩૧	પટેલ ગીતાબેન જે.	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦		ફાળવણી એસ્ટેટ
૮૬	૮૭૧૮	પટેલ જ્યસુખભાઈ જે.	સીની.કલાર્ક ૩૪૮૦૦-૧૧૨૪૦૦	વ્ય.વેરો	
૮૭	૮૦૪૪૭	શ્રી મનુજ ચંદુજ ઠકોર	જુની.કલાર્ક ૧૯૬૦૦-૬૩૨૦૦	ડીસ્પેસ કલાર્ક / ડી.સુ. કલાર્ક	
૮૮	૮૧૨૪૫	શ્રી મનોજ કે.પટેલ	જુની.કલાર્ક ૧૯૬૦૦-૬૩૨૦૦	ડીસ્પેસ કલાર્ક / ડી.સુ. કલાર્ક	
૮૯	૩૩૮૨૮	શ્રી લક્ષ્માણભાઈ ખેમયંદ	ફીટર ૧૯૬૦૦-૬૩૨૦૦		

૮૦	૩૪૨૦૩	શ્રી ધર્મન્દ્રભાઈ ઈન્ડ્રેકર	પટાવાળા ૧૬૬૦૦-૬૩૨૦૦		ફાળવણીથી ગયેલ કાઉ.કક્ષ
૮૧	૩૬૧૫૬	શ્રી ગુણવંતભાઈ વાધેલા	મજુર ૧૪૮૦૦-૪૭૧૦૦		
૮૨	૩૬૧૫૭	શ્રી અતુલભાઈ અમીન	મજુર ૧૪૮૦૦-૪૭૧૦૦		
૮૩	૭૬૨૧	પ્રવીણસિંહ ચૌહાણ	પટાવાળા ૧૬૬૦૦-૬૩૨૦૦	વ્ય.વેરો	
૮૪	૮૧૫૪૬	શ્રી ચંદુભાઈ એસ.પટેલ	પટાવાળા ૧૪૮૦૦-૪૭૧૦૦		
૮૫	૮૭૦૧૨	શ્રી સત્યનારાયણ જાંગિડ	લુણાર ૧૬૬૦૦-૬૩૨૦૦		
૮૬	૮૭૦૦૮	શ્રી કેશવભાઈ વાળા	લુણાર ૧૬૬૦૦-૬૩૨૦૦		
૮૭	૬૮૨૦	શ્રી પ્રવિષભાઈ બી.પરમાર	સીની.કલાર્ક ૩૪૪૦૦-૧૧૨૪૦૦		હેલ્થ પશ્યિમ ઝોન એચ.એસ.બી.સી.ખાતે ફાળવણી
૮૮	૮૦૪૨	શ્રી હિલીપકુમાર વી.સુખવાળી	હેડ કલાર્ક ૩૪૪૦૦-૧૧૨૪૦૦		ઉત્તર ઝોન વહિવટ ખાતે ફાળવણી
૮૯	૮૧૬૩	શ્રી યોગેશભાઈ એન.પ્રજાપતી	આસી.મેનેજર ૫૩૧૦૦-૧૬૭૮૦૦		SVPIMSR ખાતે ફાળવણી
૧૦૦	૮૫૨૫	શ્રી જીજનેશ બી.પટેલ	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી નવા પ.ઝોન ખાતે
૧૦૧	૮૫૩૬	શ્રી શાહ સેજલ કી.	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		ફાળવણી પ.ઝોન વહિવટ ખાતે
૧૦૨	૮૮૧૧	શ્રી પારુલબેન મુકેશ ભાવસાર	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦	વ્યવસાયવેરા	
૧૦૩	૬૦૩૦૧	શ્રી આકાશ ડાલ્યાભાઈ દવેરા	જુની.કલાર્ક ૨૫૫૦૦-૮૧૧૦૦		

**(૧૦) તેઓને મળતા માસિક વળતર :-**

**બીટ વિભાગની કચેરી તથા અધિકારીની માહિતી**

**(૧૧) આર્થિક સહાય કાર્યક્રમો :-**

આ વિભાગને લાગુ પડતું નથી.

**(૧૨) આપેલ છુટાછુટ વિગેરે :-**

બી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૮ ની જોગવાઈઓ, વખતોવખતના પરિપત્રો, આદેશ, જોગવાઈઓ સમક્ષ સત્તાની મંજુરી મુજબ બંધ ખાલી/ઈન્સેન્ટીવ રીબેટ વિગેરે લાભ આપવામાં આવે છે.

**(૧૩) ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ વિગતો :-**

ટેનામેન્ટ નંબર આધારિત ભિલકતના ટેક્ષને લગતી માહિતી કોમ્પ્યુટરમાં અ.મ્યુ.કો.ની વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર ઉપલબ્ધ છે.

**(૧૪) ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગત :-**

આ વિભાગને લાગુ પડતું નથી.

## જાહેર માહિતી અધિકારીઓના નામો,હોદ્દો

### આર.ટી.આઈ.અન્વયે ટેક્ષ પણ્થિમ ઝોનના સ્ટાફની માહિતી

જાહેર માહિતી અધિકારી	<p>આસી.મેનેજરશ્રી</p> <p>૧. શ્રી મનીપભાઈ શાહ વોર્ડ નં.૦૫૦૧ થી ૦૫૦૭,૦૫૧૫ થી ૦૫૨૧ ૦૫૨૮ થી ૦૫૩૬,૦૫૬૫ થી ૦૫૭૪ ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૨૮</p>
	<p>૨. શ્રી મનીપભાઈ શાહ વોર્ડ નં.૦૫૦૮ થી ૦૫૧૪ ૦૫૨૨ થી ૦૫૨૮-૦૫૬૧ ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૨૦</p>
	<p>૩. શ્રી સોનીયાબેન ભાવસાર વોર્ડ નં.૦૫૪૧-૦૫૪૫ અને ૦૫૫૧-૦૫૫૨ ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૩૫ વ્યવસાયવેરા વિભાગ (પણ્થિમ ઝોન)</p>
જે તે બીટના ટેક્ષ માહિતી અંગેના અપીલ અધિકારી બાબતની.	<p>૩.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર (પ.ઝોન) શ્રી દિપકભાઈ પટેલ ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૩૪</p>
સમગ્ર ટેક્ષ પણ્થિમ ઝોન બાબતના જાહેર માહિતી અધિકારી	<p>૩.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર (પ.ઝોન) શ્રી દિપકભાઈ પટેલ ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૩૪</p>
સમગ્ર ટેક્ષ પણ્થિમ ઝોન બાબતના અપીલ અધિકારી	<p>શ્રી નરેશભાઈ રાજપુત આસી.ભૂનિ કમિશર તથા અપીલ અધિકારી ફોન નં.૨૭૫૫૨૦૪૭ એ.નં.૨૩૩ ડો.રમણભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૧૩.</p>

## અનેક્ષર-એ

(સામાન્ય વહીવટી વિભાગના તા.૦૧-૦૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-આરટીઆઈ સેલનું બીડાણ)

### પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે ટેક્ષ પશ્ચિમ ઝોનના કાર્યક્ષેત્રની આ સાથે યાદી મુજબ જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ કલમ-૦૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો પ્રોએક્ટીવ ડીસ્કલોગર (પીએડી) અગાઉ તૈયાર કરવામાં આવી છે. અને તા. ૩૦-૦૬-૨૦૧૮ ની સ્થિતિએ તે અધતન કરવામાં આવેલ છે.

૨૦૧૮-૧૯ ની સ્થિતિએ હવે ટેક્ષ પશ્ચિમ ઝોન ખાતાના પ્રોએક્ટીવ ડીસ્કલોગરનું ઇન્સપેક્શન કમ ઓડિટ બાકી રહેલ નથી.

આસી.મેનેજર  
(પશ્ચિમ ઝોન)

ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર  
(પશ્ચિમ ઝોન)

આસી.મ્યુનિ કમિશર  
(પશ્ચિમ ઝોન)

ડે.મ્યુનિ કમિશર  
(પશ્ચિમ ઝોન)